### S. M. GOLD LIMITED

CIN: L74999GJ2017PLC098438

Registered Office: Shop No. 1 to 3, 2<sup>nd</sup> Floor, 24 caret Building, Opp. ROK Regency Hotel, Law Garden, C G Road, Ahmedabad-380009

Website: www.smgoldltd.com

E-mail: compliancesmgold@gmail.com Contact: +91 9428980017

To Date: February 13th, 2025

#### The General Manager Listing,

The Corporate Relations Department, BSE LIMITED
PJ Towers, 25th floor, Dalal Street,
Mumbai -400 001
Scrip Code:542034

# <u>Sub: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015</u>

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of financial results of the Company for the quarter and nine months ended 31st December, 2024 published in the following newspapers on 13th February, 2025:

- 1. Indian Express (English)
- 2. Financial express (Gujarati)

For, S. M. GOLD LIMITED


SHAH

Pulkitkumar Sureshbhai Shah Managing Director (DIN: 07878190)

## SALUTE THE SOLDIER



BORDER SECURITY FORCE CT JAWAHAR RAM 01.10.1960 - 13.02.1990 Bordermen Salute and proudly remember today their brave comrade, who made supreme sacrifice



CT DEBASHIS ROY SARKAR

15.12.1985 - 13.02.2019 Bordermen Salute and proudly remember today their brave comrade, who made supreme sacrifice while fighting Anti National Elements on Indo-BD



10.05.1969 - 13.02.1995 Bordermen Salute and proudly remember today their brave comrade, who made supreme sacrifice

CT ANIL P



while fighting militants in area of Lethora (J&K). CT HARIKESH PRASAD

04.05.1986 - 13.02.2016 Bordermen Salute and proudly remember today their brave comrade, who made supreme sacrifice while fighting naxals in area of Sangam Bazar, Pakhanjure, Chhattisgarh.

#### CENTRAL RESERVE POLICE FORCE 13 February 1989







eer Balidani

Constable





Moirang, Bishnupur district, to counter





the insurgency. On 13 February 1989, N J Sapate while en route for an operation, 1 Bn insurgents ambushed their vehicle with heavy gunfire. Trapped on a narrow road under intense fire from a dominant position, the CRPF troops fought back with exceptional courage. L/Nk Panch Dev Singh, L/Nk Ram Parvesh

Rai, Ct N.J. Sapate, Ct Makhan Lal, and Ct Keshav Singh made the



Veer Balidani SI/GD Raushan Kumar 205 CoBRA Bn. 1-1-1994 To 13-2-2019

13 February 2019 Acting on intelligence, troops of CoBRA launched anti-Maoist operation in the jungles near Pachrukhiya, Aurangabad. As they moved tactically, Maoists in nbush opened indiscriminate fire.

The troops retaliated fiercely, forcing the insurgents to retreat under heavy losses. While pursuing them, an IED exploded, grievously injuring SI/GD Raushan Kumar, who was leading the assault. He was evacuated to a hospital in Patna, where he succumbed to his injuries, making the supreme sacrifice in the line of duty.



Veer Balidani Constable ohammad Hani: 86 Bn 9-1-1967 To 13-2-1988

13 February 1988 onstable Mohammad Hanif of 86 Battalion was deployed in Muktsar, Punjab, for law enforcement and anti-terror operations. On 13 February 1988, while conducting a search with SHO Sadar Malout in

village Raniawala, the team came under fire from terrorists hiding in a house. Despite sustaining bullet injuries, Ct Hanif eliminated one terrorist before making the supreme sacrifice. For his indomitable courage and unwavering duty, he was posthumously awarded the President's Police Medal for Gallantry.



Veer Balidani Constable 130 Bn 15-7-1974 To

13 February 2001 13 February 2001, 130 Battalion of CRPF was conducting area domination in Sopore, Baramulla, for panchayat elections. As the troops returned to camp, militants near Tarzoo

ambushed them with heavy fire. Amid the fierce exchange, Ct Mahabir Prasad Gujjar spotted a militant fleeing into a by-lane. Without hesitation, he broke cover and pursued him. A hidden militant opened fire, seriously injuring him. Despite his wounds, he retaliated, hitting the attacker, who managed to escape. The braveheart succumbed to his injuries during evacuation, making the supreme sacrifice.

# The TGTransco invites online Bids under e-procurement for supply of the following

ı	SI.No.	Name of the work	Specification No.
ı	1	132kV 70kN & 120kN SRC Insulators	TGPMM22-04/2025
ı	2	220kV 70kN & 120kN SRC Insulators	TGPMM22-05/2025
ı	3	70kN & 120kN Anti Fog Disc Insulators	TGPMM22-06/2025
		s can have further details and download the ten	

040-23396000 (Extn.: 3487/3583/3460/3332) 040-23303736, www.tgtran

कार्यालय अतिरिक्त मुख्य अभियंता, सा.नि.वि. संभाग द्वितीय उदयपुर मु. बाँसवाड़ा

निविदा संशोधन सूचना (13/2024-25)

(NIB CODE:- PWD2425A3684, UBN No. PWD2425WLOB13359) इस कार्यालय द्वारा जारी निविदा सचना संख्या 13/2024-25 में -निविदा जमा कराने की तारीख को दिनां 05.02.2025 से 13.02.2025 एवं निविदा खोले जाने कि तारीख को **दिनांक** 06.02.2025 से 14.02.202 संशोधित किया जाता है। निविदा की अन्य शर्ते यथावत रहेंगी।

(बी.एल. भेणिया अतिरिक्त मुख्य अभियन सा.नि.वि. संभाग द्वितीय उदयपुर मु. बाँसवाड़

DIPR/C/1692/2025

GOVERNMENT OF GUJARAT NARMADA, WATER RESOURCES, WATER SUPPLY AND

KALPSAR DEPARTMENT ON LINE TENDER NOTICE NO. 1 OF 2024-25 of Governor of Gujarat State, Executive Engineer, Dharoi Irrigation Sub Division Idar(Himatnagar) (Phone:02772-228859) invitestenders for 1work(from contractor registered in appropriate Class in Narmada, Water Resources, Water Supply and Kalpsar department and/or Road and Building Department of Gujarat

1. For 01 works Estimate Amt. Rs.4.17 lacs for Tender download Dt.13-02-2025 to 27-02-2025 up to 18.10 Hrs. Submission of EMD, Tender Fee and other documents up to Dt.06-03-2025 up to 16.00 Hrs. (By Registered Post AD / Speed Post Only) & Opening of tender on Dt.28-02-2025 at

Any Amendment in the tender will have to be verified online. More information contact this office & see https://tender.nprocure.comwebsite tender can be downloaded from website https://tender.nprocure.com INF-HMT-448-2025

# PUBLIC NOTICE

NOTICE REGARDING LOSS OF EQUITY SHARE CERTIFICATE(S) OF ICICI , Regd Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodra. I, Sunil Kumar Dhawan residing at 234-G, DDA MIG Green Flats, Rajouri Garden, New Delhi-110027, the registered holder(s) of the under mentioned shares held in the above said company, hereby give notice that the share certificate(s) in respect of the said shares have been untraceable and we have applied to the Company for issue of duplicate certificate(s). Any person having claim in respect of the said shares should lodge such claims with the Company at its above referred address within 15 days from this date, else the Company will proceed to issue duplicate certificate(s) and no further claim will be entertained by the Company thereafter

Folio No.	Distinctive Number	No. Of Equity Shares	Face Value
1046563	5831219404- 5831219483	80	2
1046563	16250801- 16251600	800	2
Place: Nev	v Delhi		Sd/-

**Sunli Kumar Dhawan** 

## ASHTASIDHHI INDUSTRIES LIMITED

(FORMERLY KNOWN AS GUJARAT INVESTA LIMITED) CIN: L17100GJ1993PLC018858

Regu. Office. 202, New Cloth Market, Opp. Nalpul Gate, Allifiedabad - 300002, Gujarat
Email: gujarat.investa@gmail.com
Jnaudited Standalone Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2024
(Rs. In Lakhs)

	1,						
		Ql	QUARTER ENDED			THS ENDED	YEAR Ended
Sr.		31-12-24	30-09-24	31-12-23	31-12-24	31-12-23	31-03-24
No.	PARTICULARS	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from Operations	44.18	41.55	11.00	121.15	21.35	78.14
2	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional items)	-0.58	-1.43	-1.04	2.96	2.98	-38.95
3	Net Profit/(Loss) for the period (Before Tax and after Exceptional items)	-0.58	-1.43	-1.04	2.96	2.98	-38.95
4	Net Profit/(Loss) for the period (after Tax and Exceptional items)	-0.58	-2.47	-1.04	1.92	2.98	-38.95
5	Total Comprehensive income for the period Profit/ (Loss) for the period (After Tax) and other comprehensive income (after Tax)	-0.58	-2.47	-1.04	1.92	2.98	-38.95
6	Paid-up Equity share capital (face value) of Rs. 10/- each share	750.99	750.99	750.99	750.99	750.99	750.99
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-			-	269.69
8	Earnings Per Share (before and after extraordinary items) (of Rs. 10/- each) Basic and Diluted	0.00	-0.03	(0.01)	0.03	0.04	-0.52

Notes: The above result is an extracts of the details unaudited Financial Results for the quarter and Nine Months ended 31st December, 2024 filed with the stock exchange under regulation 33 of SEBI( Listing Obligation and Disclosure Requirement Regulation, 2015. The full financial results for the Quarter and Nine Months ended on 31st December 2024 are available on the website of the stock exchange i.e www.bseindia.com and website of the company i.e www.gujaratinvesta.com. The same can be accessed by scanning the QR Code provided below FOR, ASHTASIDHHI INDUSTRIES LIMITED (Formerly known as Gujarat Investa Limited)

Place: Ahmedabad Date: 12-02-2025

Chairman & Director (DIN-00396869)

# S.M. GOLD LIMITED

CIN: L74999GJ2017PLC098438

Regd. Office: Shop No. 1 to 3, 2nd Floor, 24 Caret Building, Opp. Rock Regency Hotel, Law Garden, C G Road, Ahmedabad, Gujarat-380009. Email id: compliancesmgold@gmail.com; Tel. No.: 079-22114411; Web: www.smgoldltd.com

					(1	Rs. in Lacs)
Sr.		Quarte	Ended	9 Months	Ended	Year Ended
No.	Particulars	31-12-24	30-09-24	31-12-24	31-12-23	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income	3151.27	4160.96	7312.23	4443.52	6321.95
2	Net Profit for the year before tax	16.93	43.41	60.34	120.64	134.55
3	Net Profit for the year after tax	13.93	33.41	47.34	94.64	119.13
4	Total Comprehensive Income for the year	13.93	33.41	47.34	94.64	119.13
5	Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)	1003.75	1003.75	1003.75	1003.75	1003.75
6	Other Equity Excluding Revaluation Reserve		-	-	_	-
7	Earnings per share (Face Value of Rs. 10/- each)					
	Basic	0.14	0.33	0.47	0.94	1.19
	Diluted	0.14	0.33	0.47	0.94	1.19

- (1) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of
- Directors at their meeting held on 12.02.2025 (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone Unaudited financial results for the quarter and nine months ended on December 31, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.
- (3) The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Regulations, 2015, The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.
- The figures for the previous quarters/periods are re-arranged/re-grouped, wherever considered necessary.

Place: Ahmedabad Date: 12-02-25

For and on behalf of S.M. Gold Limited

Pulkitkumar Sureshbhai Shah Managing Director DIN: 07878190

# Alembic\

Extract of U

**ALEMBIC PHARMACEUTICALS LIMITED** CIN: L24230GJ2010PLC061123

Regd. Office: Alembic Road, Vadodara - 390 003 Tel.: +91 265 6637000 Website: www.alembicpharmaceuticals.com Email: apl.investors@alembic.co.in

#### NOTICE OF POSTAL BALLOT & **E-VOTING FACILITY TO THE MEMBERS**

Members are hereby informed that pursuant to the provisions of Section 108 and 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, ("the Rules") General Circular Nos. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, 09/2024 dated 19th September, 2024 and other related circulars issued by the Ministry of Corporate Affairs (hereinafter collectively referred to as "MCA Circulars"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations, 2015"), Secretarial Standard on General Meetings ("SS-2") and other applicable laws, rules and regulations (including any statutory modification or re-enactment thereof), the Company has, through National Securities Depository Limited ("NSDL") sent the Postal Ballot Notice ("Notice") dated 3rd February, 2025 vide e-mail on Wednesday, 12th February, 2025, to members, seeking their approval in respect of the Special Resolution mentioned in the said Notice.

In compliance with the MCA Circulars, the Notice is being sent only by electronic mode to those members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on Friday, 7th February, 2025 ("Cut-Off Date") received from the Depositories and whose e-mail address is registered with the Company / Depositories. A person who becomes a member after Cut-Off Date should treat the Notice for information purpose only.

Further, in compliance with the MCA Circulars, the Company has made necessary arrangements for the members to register their e-mail address. Members who have not registered their e-mail addresses are requested to register the same (i) with the Depository Participants ("DP") where they maintain their demat accounts, if the shares are held in electronic form; and (ii) with MUFG Intime India Private Limited ('MIIPL'), Registrar and Transfer Agents of the Company, by submitting their KYC details in prescribed ISR-1 format along with the supporting documents, if the shares are held in physical form. The form is available on the website of the Company at https://www.alembicpharmaceuticals.com/investor-related-forms/ and on the website of MIIPL at https://web.in.mpms.mufg.com/KYC-downloads.html. The said Notice is also available on Company's website at https://alembicpharmaceuticals.com/notices-correspondences-disclosures, website of stock exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com.

Members are requested to provide their assent or dissent through e-voting only. The Company has engaged NSDL for providing e-voting facilities to the members, enabling them to cast their vote electronically. Some of the important

actual regulating the evening the provided hereafter.					
Commencement of e-voting period	Saturday, 15 <sup>th</sup> February, 2025 at 9:00 a.m. IST.				
End of e-voting period	Sunday, 16th March, 2025 at 5:00 p.m. IST. The e-voting module will be disabled by				

NSDL thereafter. Once the vote on a resolution is cast by the shareholder, the shareholder shall not be allowed to change it subsequently or cast the vote again.

The instructions for e-voting are provided in the Notice. The said Notice also contains instructions with regard to login credential for members, holding shares in physical form or in electronic form, who have not registered their e-mail addresses either with the Company or their DP.

In case of any queries/grievances connected with e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of NSDL at www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL at evoting@nsdl.com.

For Alembic Pharmaceuticals Limited

Place : Vadodara Manisha Saraf Date: 12th February, 2025 **Company Secretary** 

SD/-

Purushottam R. Agarwal

# MAHALAXMI FABRIC MILLS LIMITED

CIN NO.: L17100GJ1991PLC015345

Registered Office: "Mahalaxmi House", YSL Avenue, Opp. Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad - 380 015, Gujarat. Ph. No.: 079 - 4000 8000, E-mail: cs@mahalaxmigroup.net, Website: www.mahalaxmigroup.net/MFML

#### EXTRACT OF UNAUDITED (STANDALONE AND CONSOLIDATED) FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2024

(₹ in Lacs, Except EPS)

$\vdash$	(till Edds, Except El 5)						
			Standalone			Consolidated	
Sr. No.	Particulars	Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Quarter Ended	Nine Months Ended	Quarter Ended
		31/12/2024 (Unaudited)	31/12/2024 (Unaudited)	31/12/2023 (Unaudited)	31/12/2024 (Unaudited)	31/12/2024 (Unaudited)	31/12/2023 (Unaudited)
1	Total Income from Operations (Net)	1634.02	5960.66	2384.89	3988.18	12803.35	4908.96
2	Net Profit / (Loss) for the period	-365.75	-492.38	-38.06	-233.29	-7.50	48.47
	(Before Tax, Exceptional and / or Extraordinary Items #)						
3	Net Profit / (Loss) for the period before Tax	-365.75	-492.38	-38.06	-233.29	-7.50	48.47
	(After Exceptional and / or Extraordinary Items #)						
4	Net Profit / (Loss) for the period after Tax	-206.10	-295.17	-38.30	-106.90	68.11	33.30
	(After Exceptional and / or Extraordinary Items #)						
5	Total Comprehensive Income for the period	-203.00	-284.91	-35.33	-103.81	78.37	36.27
	[Comprising Profit / (Loss) for the period (After Tax)						
	and Other Comprehensive Income (After Tax)]						
6	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1062.03	1062.03	1062.03	1062.03	1062.03	1062.03
7	Earnings Per Share						
	Basic:	-1.94	-2.78	-0.36	-1.01	0.64	0.31
	Diluted:	-1.94	-2.78	-0.36	-1.01	0.64	0.31
	1						

# There was no Exceptional and / or Extraordinary items during the Third Quarter and Nine Months ended on December 31, 2024.

- 1. The above is an extract of the detailed Unaudited (Standalone and Consolidated) Financial Results for the Third Quarter and Nine Months ended on December 31, 2024, under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited (Standalone and Consolidated) Financial Results for the Third Quarter and Nine Months ended on December 31, 2024, are available on the Stock Exchanges' website i.e. www.bseindia.com & www.nseindia.com and on the Company's website i.e. www.mahalaxmigroup.net/MFML
- The Unaudited (Standalone and Consolidated) Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective Meetings held on February 11, 2025.
- The Hon'ble National Company Law Tribunal, Ahmedabad, Special Bench, Court-1, vide Order dated 04th March, 2024, sanctioned the Scheme of Arrangements involving Demerger between Mahalaxmi Rubtech Limited (MRT) (CIN:- L25190GJ1991PLC016327) ("Demerged Company"); Mahalaxmi Fabric Mills Limited (MFML) (CIN:- L17100GJ1991PLC015345) ("First Resulting Company"); and Globale Tessile Limited (GTL) (CIN:- L17299GJ2017PLC098506) ("Second Resulting Company") and their respective Shareholders and Creditors ("Scheme"). The Scheme became effective on April 01, 2024, upon filing of the Certified Copy of the NCLT Order sanctioning the Scheme, by all the Companies, with the Registrar of Companies, Ahmedabad. These Financial Results have been prepared after giving effect of the Scheme w.e.f. April 01, 2022 i.e. Appointed Date. Pursuant to the Scheme becoming effective, the First Demerged Undertaking i.e. Traditional Textiles Processing Division, of the Demerged Company has been transferred to and vested in Mahalaxmi Fabric Mills Limited, with effect from 01st April, 2022. i.e. the Appointed Date. Accordingly, this Restated Financial Results includes Financial Information for the First Demerged Undertaking of the Demerged Company.
- Pursuant to the Scheme, Mahalaxmi Exports Private Limited has become the Wholly Owned Subsidiary Company of MFML.
- Pursuant to the Scheme, Financial information for Quarter ended 31/12/2023 and Nine Months ended 31/12/2023 have been restated.
- To facilitate comparison, figures of previous period have been regrouped, restated and rearranged, wherever necessary.
- These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) as specified in the Companies (Indian Accounting Standards) Rules, 2015 (As amended from time to time), Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (As amended from time to time), Circulars and Notifications issued thereunder.
- The Consolidated Financial Results comprise of financial data of Mahalaxmi Exports Private Limited (CIN: U17299GJ2019PTC110673), Wholly Owned Subsidiary Company of MFML.

By Order of the Board For, Mahalaxmi Fabric Mills Limited

**Anand Jeetmal Parekh** Managing Director (DIN: 00500384)



Regional Office - Bhuj: First Floor, Dhanraj Building, College Road, Bhuj - Kutchh - 370 001

Date: February 12, 2025

Place: Ahmedabad

#### SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES APPENDIX- IV-A [See proviso to Rule 8 (6)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, Physical possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", and "As is what is" & "Whatever There is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower(s) / Mortgagor (s) / Guarantor (s) / Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & time, EMD and Bid increase Amount are mentioned below:

Sr. No.	Name Of Secured Creditor (Branch) / Name & address of Borrower/s / Guarantor/s / Mortgagor/s	Description of the Immovable Property with known Encumbrances, if any	Total Dues. (As on 03.02.2025)	Date & Time of E-Auction	Reserve Price EMD, Bid Increase Amount (in Rs.)	Status of Possession	Property Inspection Date & Time
	Anjar Branch, Dist.: Kutch Shri Deepak Kanaksinh Padhiar (Guarantors / Mortgagors), House No. 76, Chitrakut Society - III - A, Anjar - 370 110, Kutch Smt. Gauriben Kishore Chawda (Guarantors / Mortgagors), House No. 147, Bhaveshwamagar - 1, Ward No. 12, Ta.: Anjar, Dist.: Kutch	All the Piece & Parcel of the Residential Property Flat No. 201, bearing Revenue Survey No. 65/1 paiki 66 & 67, Plot No. 81, 82, 91 & 92, Flat No. 201 (Admeasuring Area 65.98 Sq. Mtrs.) situated on Second Floor, Apartment Name "Alkananda Society", Gram Panchayat Property No. 5/4/138-81-82-91-92/C-2 in Mundra Ta.: Mundra, Dist.: Kutch. Bounded by: North: Plot No. 87 to 90, South: Staircase Towards Second Floor, East: Flat No. 202, West: 6 Sq. Mtr. Wide Road	Six Lakh Seventy Thousand Two Hundred Twenty Six Only) plus further interest	02.00 PM to	Reserve Price : 5,30,000/- EMD : 53,000/- Bid Increase Amount : 1,000	Physical	03.03.2025 11.00 AM to 1.00 PM
	Anjar Branch, Dist.: Kutch  1. Smt. Deenaben Deepak Padhiar, Revenue Survey No. 65/1 paiki, 66 & 67, Plot No. 81, 82, 91 & 92, Flat No. 202 (Admeasuring Area 65.98 Sq. Mtrs.), situated on 2nd Floor, Apartment Name "Alaknanda Society", Gram Panchayat Property No. 5/4/138-81-82-91-92/C-2 in Taluka: Mundra, District: Kutch. Address 2: House No. 76, Chitrakut	All the Piece & Parcel of the Residential Property Flat No. 202, bearing Revenue Survey No. 65/1 paiki 66 & 67, Plot No. 81, 82, 91 & 92, Flat No. 202 (Admeasuring Area 65.98 Sq. Mtrs.) situated on Second Floor, Apartment Name "Alkananda Society", Gram Panchayat Property No. 5/4/138-81-82-91-92/C-2 in Mundra Ta.: Mundra, Dist.: Kutch. Bounded by: North: Plot No. 87 to 90, South: Staircase Towards Second Floor, East: Flat No. 203, West: Flat No. 201	Eighteen Lakh Fifty Nine Thousand One Hundred Forty Two Only) plus further	02.00 PM to 06.00 PM	Reserve Price : 4,80,000/- EMD : 48,000/- Bid Increase Amount : 1,000	Physical	03.03.2025 11.00 AM to 1.00 PM
	Society - III - A, Anjar, District : Kutch.  2. Shri Deepak Kanaksinh Padhiar (Guarantors / Mortgagors), House No. 76, Chitrakut Society - III - A, Anjar, District : Kutch  3. Smt. Gauriben Kishore Chawda (Guarantors / Mortgagors), House No. 147, Bhaveshwarnagar - 1, Ward No. 12, Anjar, Kutch	All the Piece & Parcel of the Residential Property Flat No. 203, bearing Revenue Survey No. 65/1 paiki 66 & 67, Plot No. 81, 82, 91 & 92, Flat No. 203 (Admeasuring Area 55.30 Sq. Mtrs.) situated on Second Floor, Apartment Name "Alkananda Society", Gram Panchayat Property No. 5/4/138-81-82-91-92/C-3 in Mundra Ta.: Mundra, Dist.: Kutch. Bounded by: North: Plot No. 87 to 90, South: Flat No. 204 and Staircase,			Reserve Price : 4,00,000/- EMD : 40,000/- Bid Increase Amount : 1,000		

East: Balcony of Flat No. 203, there after 06 Mtrs. Wide Road, West: Flat No. 202 Last date of EMD submission Date is: 06.03.2025 Upto 6:00 PM

For detailed terms and conditions of sale of Property, please refer to the website link https://www.bankofbaroda.in/e-auction.htm and https://baanknet.com Also, prospective bidders may contact the Authorized Officer: Anjar Branch: 9687639446

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 9 (1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002



Ahmedabad

Date: 12.02.2025 (In The Event Of Any Discrepancy Between The English Version And Vernacular (Gujarati) Language Version Of This Auction Notice, The English Version Shall Prevail) Place : Bhuj, Dist. Kutch

# તાતા એલેક્સી, ગરુડ એરોસ્પેસે ડ્રોન સેન્ટર માટે હાથ મિલાવ્યા

પીટીઆઈ મુંબઈ, તા. ૧૨

સ્થાપવા માટે ડ્રોન ઉત્પાદક ભારતીય

ડિઝાઇન અને ટેકનોલોજી કંપનીઓએ બેંગલુરુમાં ચાલી એલક્સી અને ગરૂડ એરોસ્પેસ ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ છે, તે વ્યવસાયિક સંપાદન ઓપરેશનલ સર્વિસ પ્રોવાઇડર તાતા રહેલાસંરક્ષણ અને એરોસ્પેસ એરો ઈન્ડિયા ૨૦૨૫માં અને પ્રમાણપત્રનું નેતૃત્વ અને ડિલિવરીનું નેતૃત્વ કરશે, એલેક્સીએ સ્વદેશી ડ્રોન શો, એરો ઈન્ડિયા ૨૦૨૫માં પ્રોટોટાઇપ્સ, ડિઝાઇન અને કરશે, જે એવિઓનિક્સ, એમ તેમણે જણાવ્યું હતું. આ ગરુડ એરોસ્પેસ સાથેની કરી રહ્યા છીએ, એમ તાતા મેળવશે. ટેકનોલોજી વિકસાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર ઓપરેશનલ યુએવી પ્રદર્શિત લઘુચિત્રીકરણ, ગ્રાઉન્ડ પહેલ હેઠળ વિકસિત ડ્રોન પે- અમારી ભાગીદારી ભારતની એલક્સીના રેલ અને ઓફ-એન્જિનિયરિંગ કર્યા છે, તેમાં ખાસ કરીને કૃષિ કરી રહી છે. આ ઉપરાંત કન્ટ્રોલ સિસ્ટમ્સ, સુરક્ષિત લોડ મેનેજમેન્ટ, ગુડ્સ એરોસ્પેસ મહત્વાકાંક્ષાઓમાં હાઇવેના એરોસ્પેસના વડા રોજગારીની નવી તકોનું સંરક્ષણ નિદર્શન સ્વાયત્ત યુએવી ઓપ્ટિમાઇઝેશનમાં તેની આઇએસઆર (ઇન્ટેલિજન્સ,

કેન્દ્રમાં વિકસિત કરવાની એમ તાતા એલેક્સીએ જોડાણ હેઠળ, તાતા એલક્સી ગરુડ એરોસ્પેસ, જે સંરક્ષણ એપ્લિકેશનોને પૂરી કરશે, જે સંરક્ષણ

અને સર્ટિફિકેશન સેન્ટર અને સ્માર્ટ શહેરોની સાથે સ્વદેશી યુએવી ઘટકોનું સંદેશાવ્યવહાર અને ઊર્જા ડિલિવરી, સચોટ કૃષિ અને એક મુખ્ય સીમાચિદ્ધરૂપ છે. જયરાજ એઆઈ-સંચાલિત જણાવ્યું હતું. કંપનીએ ક્ષેત્રમાં કાર્યબળના વિકાસમાં ગરુડ એરોસ્પેસ સાથે એપ્લિકેશનો હશે, જે મેક ઇન ટેકનોલોજીમાં ભારતની કુશળતાનો ઉપયોગ કરશે. સર્વેલન્સ અને રિકોનિસન્સ) યુએવી પ્રગતિઓને આગળ જણાવ્યું હતું કે ભારતીય ફાળો આપશે, એમ તેમાં ભાગીદારી કરી છે. સૂચિત ઈન્ડિયા પહેલને ટેકો આપે છે, પ્રગતિને ઉજાગર કરે છે. આ મૂળ ઉપકરણ ઉત્પાદક તરીકે મિશન જેવી બહુવિધ ધપાવીને, અમે ભારતની સંરક્ષણ દળો અને સરહદી જણાવ્યું હતું.

ઇકોસિસ્ટમને સુરક્ષા દળ આ સહયોગના તકનીક, જેના માટે બંને બુધવારે જણાવ્યું હતું. તાતા યુએવી 💎 સબસિસ્ટમ્સની ક્ષેત્રમાં મજબૂત હાજરી ધરાવે તમામ ઉદ્યોગોમાં મહત્ત્વપૂર્ણ મજબૂત કરી રહ્યા છીએ અને મુખ્ય લાભાર્થીઓ હોવાની એરોસ્પેસ તકનીકોમાં દેશના અપેક્ષા છે, જે અત્યાધુનિક જરૂરિયાતોને પૂર્ણ કરશે. આત્મનિર્ભરતાને મજબૂત યુએવી ક્ષમતાઓની એક્સેસ

રાજપાંડિયને સર્જન કરશે અને એરોસ્પેસ

#### JHARKHAND ROAD PROJECTS IMPLEMENTATION COMPANY LIMITED

Registered Office: 443/A, Road No 5, Ashok Nagar, Ranchi-834002. http://www.itnlindia.com/JRPICL-SPV.aspx CIN: U45200JH2009PLC013693

Statement of Financial Results for the quarter and period ended December 31, 2024

	Statement of Financial Results for the q	uarter and period	ended beceimbe	31, 2024			
							(Rs. in Lakhs)
	Quarter ended Period Ended				Ended	Year Ended	
	Book and and	Dec 31, 2024	Sept 30, 2024	Dec 31, 2023	Dec 31, 2024	Dec 31, 2023	March 31,
	Particulars	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	2024
						2	(Audited)
1	Total Income from Operations	9,308	7,711	8,467	24,671	27,255	35,064
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(2,128)	(61)	(1,488)	(665)	(875)	(8,677)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2,128)	(61)	(1,488)	(665)	(875)	(8,677)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(2,128)	(61)	(1,488)	(665)	(875)	(8,677)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after	(2,128)	1,523	(7,803)	(665)	(875)	(8,677)
	tax) and Other Comprehensive Income (after tax))						
6	Paid-up equity share capital (face value - ₹ 10 per share)	25,950	25,950	25,950	25,950	25,950	25,950
7	Reserves (excluding revaluation Reserve)	(53,042)	(50,916)	(44,575)	(53,042)	(44,575)	(52,378)
8	Securities Premium Account		9	12	-	0	
9	Net worth	(27,093)	(24,966)	(18,625)	(27,093)	(18,625)	(26,428)
10	Paid-up Debt Capital / Outsatnding Debt	182,019	179,576	172,340	182,019	172,340	174,725
11	Outstanding Redeemable Preference Shares			-	-1		100
12	Debt Equity Ratio (number of times)	(6.72)	(7.19)	(9.25)	(6.72)	(9.25)	(6.61)
13	Earnings per share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)						
	(*Not annualised):						
	(a) Basic	(0.08)*	0*	(0.06)*	(0.26)*	(0.34)*	(3.34)
	(b) Diluted	(0.08)*	0*	(0.06)*	(0.26)*	(0.34)*	(3.34)
14	Capital Redemption Reserve			-	-		15
15	Debenture Redemption Reserve	11,409	11,409	11,409	11,409	11,409	11,409
16	Debt Service Coverage Ratio (DSCR) (number of times)	-			-	0.82	1.60
17	Interest Service Coverage Patio (ISCP) (number of times)	999	100	Volta .	0.000	2 25	1 00

- The above is an extract of the detailed format of financial results filed with Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The ful format of the year financials results are available on the websites of the National Stock Exchange (NSE) -www.nseindia.com and the Company's - https://www.itnlindia.com/Jharkhand-Road-Projects
- For the items referred in the Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures can be accessed on the (www.nseindia.com) and on the Company's website - https://www.itnlindia.com/Jharkhand-Road-Projects-Implementation-Company-Limited.asp
- The above results for quarter and period ended Decmber 31, 2024 are in complinace with Indian Accounting Standards ("Ind AS") notified by the Ministry of Corporate Affairs, read with SEBI Circular No CIR/CFD/FAC/69/2016 dated August 10, 2016.
- The above financial results of the Company for the guarter ended December 31, 2024 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on February

For and on behalf of the Board

Place: Mumbai

Date: 12th February 2025

# BHARAT FORGE

Regd. Office: Mundhwa, Pune Cantonment, Pune 411 036, Maharashtra, India. CIN:L25209PN1961PLC012046

Ph. No.: 91-20-6704 2777 / 2476, Fax No.: 91-20-2682 2163 Email: secretarial@bharatforge.com; Website: www.bharatforge.com



(₹ in Million)

DIN: 02348138

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2024

Sr.	Particulars	Consolidated				
No.		Quarter ended	Quarter ended	Year ended		
		December 31, 2024 (Unaudited)	December 31, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)		
1.	Total income from operations	35,139.11	39,223.62	1,59,094.95		
2.	Net Profit/(loss) for the period (before tax and exceptional items #)	3,470.04	3,950.41	14,513.15		
3.	Net Profit/(loss) for the period before tax (after exceptional items #)	3470.04	3,950.41	14,389.92		
4.	Net Profit/(loss) for the period after tax (after exceptional items #)	2,127.80	2,544.48	9,101.59		
5.	Total comprehensive income/(loss) for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income/(loss) (after tax)]	2,068.16	2,344.16	7,870.36		
6.	Paid up equity share capital (Face value ₹ 2/- each)	956.27	931.27	931.27		
7.	Reserves excluding revaluation reserve	90,079.11	71,664.29	70,770.57		
8.	Securities premium account	23,106.65	6,930.89	6,930.89		
9.	Net worth	91,035.38	72,595.56	71,701.84		
10.	Paid up debt capital / outstanding debt	5,740.12	5,983.98	7,231.25		
11.	Outstanding redeemable preference shares	_	-0	— ·		
12.	Debt equity ratio	0.70	0.98	1.05		
13.	Earning per share (face value ₹ 2/- each)  (For continuing and discontinuing operations)  - Basic and diluted (in ₹ ) (not annualised)	4.54	5.68	20.43		
14.	Capital redemption reserve	N.A.	N.A.	N.A.		
15.	Debenture redemption reserve	N.A.	N.A.	N.A.		
16.	Debt service coverage ratio	0.52	1.75	1.70		
17.	Interest service coverage ratio	6.03	4.92	4.86		

#-Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

Note:

Place : Pune

Dated: February 12, 2025

Paratter Lance	Quarter ended	Quarter ended	Year ended
Particulars	December 31, 2024 (Unaudited)	December 31, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)
Total income from operations  Net Profit for the period before tax (after exceptional items)	21,273.26	22,979.32 5.044.07	91,309.75 18.952.31
Net Profit for the period before tax (after exceptional items)	4,726.09 3,460.40	3,778.11	14,249.57

2. Above is an extract of the detailed format of standalone and consolidated financial results for the quarter ended December 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and also on the Company's website www.bharatforge.com. For the other line items referred in regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange(s) (BSE and NSE) and can be accessed on the URL (www.bseindia.com and www.nseindia.com). Also the detailed Financial Results of the Group and the Company for the quarter ended December 31, 2024 can be accessed by scanning QR code provided below.



For BHARAT FORGE LIMITED

**B. N. KALYANI CHAIRMAN AND MANAGING DIRECTOR** DIN: 00089380





Registered Office: GIDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals, Gujarat CIN: L27104GJ1972PLC002153, Phone No: 02676-230777, Fax No: 02676-230889 Email: shares@panchmahalsteel.co.in Website: www.panchmahalsteel.co.in

Sr. No.		Quarter ended	Nine months ended	₹ in Lacs Corresponding 3 months ended in the previous year
NO.	Particulars	31-12-2024	31-12-2024	31-12-2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income	9,525.21	29,404.54	10,422.92
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	223.49	725.98	(44.03)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	223.49	725.98	(44.03)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	166.14	535.46	(32.25)
5	Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	168.30	541.96	(29.12)
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83
7	Reserves excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year (Other Equity) i.e. as at 31.03.2024		13,781.06	
8	Earnings Per Share (of ₹10/- each) (for continuing and discontinued operations) a) Basic b) Diluted	0.87 0.87	2.81 2.81	(0.17) (0.17)

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the quarter and nine-months period ended 31st December, 2024 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in. The same can be accessed by scanning the QR Code provided below.



By order of the Board **Ashok Malhotra** Chairman & Managing Directo

DIN - 00120198

Place: Vadodara Date: 12-02-2025

> Chola ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ Enter a better life કોર્પોરેટ ઓફિસ : ચોલા ક્રેસ્ટ, સુપર બી, સીપ૪ અને સીપપ, ૪, શીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગિન્ડી, ચેજ્ઞાઈ ૬૦૦૦૩૨

> > કીમાન્ક

પરિશિષ્ટ ૪ [જુઓ નિયમ ૮(૧) ] કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમેટેડના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેશદાર ને એક ડિમાન્ડ નોટિસ મોકલી હતી નોટિસમાં જણાવેલ રકમ અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી eo દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેણદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ છે, જેથી દેણદારો અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ મિલકતોનો નીચે સહી કરનારે તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ-સેક્શન (૪) સેક્શન ૧૩ ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ ક્લાજો લીધો છે. દેશદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિમાં જણાવેલ મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા ધિરાણ અને તેના પરના વ્યાજ સાથે **મેસર્સ ઢોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ** ફાઈનાન્સ કંપની લિમિટેડના ચાર્જમાં ગણાશે. સિક્ચોર્ડ અસ્ક્ચામતો છોડાવવાની ઉપલબ્ધતા સમયમર્યાદા અંગે સરફેસી કાયદાના સેક્શન ૧ ૩ના સબ-સેક્શન (૮) તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે.

रज्ञारायु नाम अन सरनामु अने बोन એકाઉन्ट नं.	નોટીસની તારીખ	ભારી કરમ	୫ଜନ୍ୟପାហੀ भିલકतनुं वर्शन	दारीज क्ष	
લોન એકાઉન્ટ નં. X0HLHTG00002898322 શ્રી/શ્રીમતી અવ્દુલસલીમ અવ્દુલકચુમ શેખ શ્રી/શ્રીમતી અવ્દુલસલીમ અવ્દુલકચુમ શેખ જ્ઞી/શ્રીમતી અભિગાબાનુ અવ્દુલસલીમ શેખ બધા રહે : પ્લોટ નં. ૬૮ અને ૬૯ મકાન નં. ૩/૧૦૩૫ અને ૧૦૩૬ તકવા મસ્જીદ પાછળ, ધરોઈ રોડ, વડાલી, ખેડબ્રહ્મા - ૩૮૩૨૩૫	R202-60-22	રૂા. ૨૦૦૦૭ <i>૯/-</i> (અંકે રૂપિયા વીસ લાખ ઈક્યોતેર પુરા) તારીખ ૧૦-૦૧-૨૦૨૪ મુજબ)	નં. ૪૪૫૨ જુનો સર્વે નં. ૧૨ પૈકી ૧/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૪/પૈકી ૪/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૧/પૈકી ૧/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૧/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૧૭૩. પ્લોટ નં. ૬૮ અને ૬૯, વડાલી નગરપાલિકા મિલકત નં. ૩/૧૦૩૫ અને ૩/૧૦૩૪ વડાલી ખાતે સ્થિત વડાલી નગરપાલિકાની હદમાં તા. વડાલી જીલ્લો સાંભરકાંઠા. (એરિયા આશર ૧૬૩.૩૧.૨૫ ચો.મી.) અને તેના ૫૨ બાંધેલ તેના પ્લોટ ના માલિક તરીકે મોજે : વડાલી નગે સર્વે નં. ૪૪૫૨ જુનો સર્વે નં. ૧૨ પૈકી ૧/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૪/પૈકી ૧/પૈકી ૪/પૈકી ૧૭૩. પ્લોટ ન. ૬૮ અને ૬૯, વડાલી નગરપાલિકા મિલકત નં. ૩/૧૦૩૫અને ૩/૧૦૩૪ વડાલી ખાતે સ્થિત વડાલી ગગરપાલિકાની હદમાં તા. વડાલી જીલ્લો સાબરકાંઠા સ્થિત આવેલ મોજે : વડાલી નગરપાલિકા, તા. વડાલી જી. સાબરકાંઠા(એરિયા આશર ૧૬૩.૩૧.૨૫ ચો.મી.) ચતુર્સીમાઓ : પૂર્વ : માર્જન પછી પ્લોટ નં. ૭૯ અને ૭૮ સ્થિત પશ્ચિમ : રોડ, ઉત્તર: માર્જીન પછી પ્લોટ નં. ૭૦, દક્ષિણ : પ્લોટ નં. ૬૭.	(ଜାତ <del>ର</del> ଜାବନ-୧୦-୬୦	
લા : 06-99-90 આત : આલ્ડકાંઠા			અધિકૃત અધિકારી, મેમર્સ ગોલામંદલમ વત્ત્વેસ્થ્યેન્ટ એન્દ્ર કાર્યનાન્ય કો	പ്പി ദ്രമുട്ട	

Regd. Office: Shop No. 1 to 3, 2nd Floor, 24 Caret Building, Opp. Rock Regency Hotel, Law Garden, C G Road, Ahmedabad, Gujarat-380009. **Email id**: compliancesmgold@gmail.com; **Tel. No.**: 079-22114411; **Web**: www.smgoldltd.com

Particulars	Quarter 31-12-24 Unaudited	30-09-24	9 Months 31-12-24		Year Ended
		30-09-24	31-12-24	record to the contract of the contract	
	Unaudited		0	31-12-23	31.03.2024
	Ollauulteu	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income	3151.27	4160.96	7312.23	4443.52	6321.95
Net Profit for the year before tax	16.93	43.41	60.34	120.64	134.55
Net Profit for the year after tax	13.93	33.41	47.34	94.64	119.13
Total Comprehensive Income for the year	13.93	33.41	47.34	94.64	119.13
Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)	1003.75	1003.75	1003.75	1003.75	1003.75
Other Equity Excluding Revaluation Reserve	_	-	_	-	-
Earnings per share (Face Value of Rs. 10/- each) Basic	0.14	0.33	0.47	0.94	1.19
	Net Profit for the year after tax  Total Comprehensive Income for the year  Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)  Other Equity Excluding Revaluation Reserve  Earnings per share (Face Value of Rs. 10/- each)	Net Profit for the year before tax  Net Profit for the year after tax  13.93  Total Comprehensive Income for the year  13.93  Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)  Other Equity Excluding Revaluation Reserve  Earnings per share (Face Value of Rs. 10/- each)  Basic  16.93  10.93  1003.75  1003.75	Net Profit for the year before tax         16.93         43.41           Net Profit for the year after tax         13.93         33.41           Total Comprehensive Income for the year         13.93         33.41           Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)         1003.75         1003.75           Other Equity Excluding Revaluation Reserve         —         —           Earnings per share (Face Value of Rs. 10/- each) Basic         0.14         0.33	Net Profit for the year before tax   16.93   43.41   60.34     Net Profit for the year after tax   13.93   33.41   47.34     Total Comprehensive Income for the year   13.93   33.41   47.34     Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)   1003.75   1003.75     Other Equity Excluding Revaluation Reserve       Earnings per share (Face Value of Rs. 10/- each)   Basic   0.14   0.33   0.47     Other Equity Excluding Revaluation Reserve       Earnings per share (Face Value of Rs. 10/- each)   10.14   0.35   0.47     Other Equity Excluding Revaluation Reserve       Earnings per share (Face Value of Rs. 10/- each)   10.14   0.36   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.37   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.37   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.37   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.37   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.37     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47     Earnings Per Share (Face Value of Rs. 10/- each)   10.14   0.38   0.47	Net Profit for the year before tax  16.93  43.41  60.34  120.64  Net Profit for the year after tax  13.93  33.41  47.34  94.64  Total Comprehensive Income for the year  13.93  33.41  47.34  94.64  Paid up Equity Share Capital (At par value of Rs. 10/- each)  Other Equity Excluding Revaluation Reserve  Earnings per share (Face Value of Rs. 10/- each)  Basic  0.14  0.33  0.47  0.94

Notes: (1) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board Directors at their meeting held on 12.02.2025

(2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone Unaudited financial results for the quarter and nine months ended on December 31, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations 8

Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity

(4) The figures for the previous quarters/periods are re-arranged/re-grouped, wherever considered necessary



For and on behalf of S.M. Gold Limited sd/-

Pulkitkumar Sureshbhai Shah Place: Ahmedabad **Managing Director** Date: 12-02-25 DIN: 07878190